



# KEMISTAR CORPORATION LTD.

CIN No. : L24233GJ1994PLCO22845

604, Manas Complex, Jodhpur Cross Road, Satellite, Ahmedabad-380015,  
Gujarat, India. **Ph** : 079-26923570 / 26923587 **Email** : kemistarbse@gmail.com

August 14, 2021

To,  
BSE Limited,  
Listing Dept. /Dept. of Corporate Services,  
Phiroze Jeejeebhoy Towers,  
Dalal Street,  
Mumbai – 400 001

Dear Sir/ Madam,

**Subject:** Submission of Newspaper Clipping

**Ref.:** Regulation 47 (1) (a) of SEBI (Listing Obligation and Disclosure Requirement) Regulations, 2015

**Scrip code:** 531163  
**Security ID:** KEMISTAR

Please find enclosed herewith Newspaper Clipping of the Audited Financial Results in compliance with Regulation 33 and 47 of **SEBI** (Listing Obligation and Disclosure Requirement) Regulations, 2015 for the Quarter ended on June 30, 2021 published in Newspaper on Friday, 13<sup>th</sup> August, 2021.

Please acknowledge receipt

Thanking You,

For, Kemistar Corporation Limited

**Trusha Shah**  
Company Secretary







EDITORIAL

Climate crisis: No one will be spared

Some recent news and headlines: Extreme flooding in Maharashtra and Himachal Pradesh in India, and Rhineland-Palatinate and North Rhine-Westphalia in Germany. Hundreds dead in floods in Henan (China). Heat wave in British Columbia (Canada) kills dozens. How do we make sense of all this? Climate scientists are wary of overstating risks, what is known is that errors (false positives). But there is a real danger of type 2 errors (false negatives). As climate risks rise, type 2 errors can give policymakers a false sense of comfort that things are not so bad. After all, climate models have actually underestimated the scale of impact even at relatively lower levels of warming. Warm weather that could result in Arctic permafrost thawing is happening 70 years ahead of climate model projections. This week, the Intergovernmental Panel on Climate Change (IPCC) released the report of its Working Group I (on the physical science of the climate crisis), laying many doubts to rest. Global surface temperatures are 1.09°C higher in 2011-2020 than in 1850-1900. The world will breach 1.5°C of warming within the next two decades with extreme events rapidly rising. Weather attribution studies investigate whether specific extreme weather events are more likely to be caused by the normal range or whether they are made more likely (and worse) due to human-induced climate crisis. Take Verkhyansk in eastern Siberia, known as the Pole of Cold for having recorded the lowest temperature north of the Arctic Circle (-67.8°C in 1892). This year, it registered the highest temperature ever within the Arctic Circle of 38°C. Studies now conclude that the severe heat wave in Siberia in 2020 would have been near-impossible without the human-caused climate crisis. The same applies to the heat wave in north-western United States and parts of western Canada this summer. We must, first, understand that extremes today could well become the norm tomorrow. Climate risks are non-linear and the past is not a good predictor of the future. Heavy precipitation events that happened once in 10 years in the pre-industrial era now likely occur 1.3 times each decade (rising to 2.8 times with 4°C of warming). South Asia and several parts of Africa will also face severe droughts with 1.5-2°C of warming. Moreover, our warning does not stop at our borders. It is tempting to dismiss disasters happening elsewhere as not being of immediate concern. But we must spot the warning signs because warming anywhere will impact our future everywhere. In the last 30 years, the Arctic region has warmed at 0.81°C per decade, more than thrice as fast as the global average of 0.23°C per decade. Melting ice is now the most important cause for sea-level rise and revised estimates predict an over one metre rise in global sea levels by 2100. This is not the Arctic's problem alone, but will severely impact coastal and low-lying areas all over the world.

Housing scam hits VMC, names of 382 beneficiaries changed

Ahmedabad : They felt fortunate to be selected for getting a house when their names got picked up in the government's lucky draws. But luck ran out even before they could be allotted the houses under the Pradhan Mantri Awas Yojna (PMAY). A massive scam unearthed in the Vadodara Municipal Corporation (VMC), allegedly misappropriated by two staffers, has revealed that names of 382 beneficiaries of PMAY had been replaced by those of some other people. The duo - Pramod Vasava, an executive engineer and Nishith Pitwa, a software expert - are accused of clandestinely changing names of the beneficiaries and uploading a fraudulent list on the civic body's website. The beneficiaries were selected in a computer draw organized on August 7 as part of the completion of five years of the Vijay Rupani government. The draw was used to allot 382 housing units at the event held at Sir Sayajirao Nagar. Based on a complaint lodged by city engineer Shaleish Mistry, an offence of criminal breach of trust by public servant and forgery was lodged at Navapura police station against them and cops picked up the duo for questioning. However, investigation was handed over to the detection of crime branch (DCB) on Thursday evening, looking at the seriousness of the scam. The scam came to light when the beneficiaries, who were allotted houses in the draw done by minister Yogenesh Patel found that their names were missing from the list on the website. When Pitwa was asked by Mistry about the anomalies in the names that were selected during the event and the list of the events, he spilled the beans. Pitwa gave a written statement that he was asked by Vasava not to publish the selected beneficiaries' list if the names shared by him on mobile phone were not selected. Pitwa was asked to run the computer draw program again and prepare a new list. Pitwa said that he had told Vasava, who is in the affordable housing department, certified the new which was later uploaded on the website.

KEMISTAR CORPORATION LIMITED

Extract of Unaudited Consolidated Financial Result for the Quarter ended on June 30, 2021 (Rs in Lacs except EPS)

Sl. No.	Particulars	Quarter ended		Year ended	
		30.06.21	31.03.21		30.06.20
1	Total Income from Operations	316.04	604.85	220.32	1410.59
2	Net Profit/(Loss) for the period (before Tax, Exceptional Item)	32.06	(11.51)	24.23	55.45
3	Net Profit/(Loss) for the period (after Tax (after Exceptional Item))	31.26	(11.51)	24.23	55.45
4	Net Profit/(Loss) for the period after tax (after Exceptional Item)	26.56	(20.23)	24.20	44.29
5	Total Comprehensive Income for the period	26.56	(20.23)	24.20	44.29
6	Equity Share Capital	1075.94	1075.94	1075.94	1075.94
7	Earnings Per Share of Rs.10/- each				
	1. Basic: (In Rs)	0.25	(0.19)	0.22	0.41
	2. Diluted: (In Rs)	0.25	(0.19)	0.22	0.41

ZOTA HEALTH CARE LIMITED  
CIN: L24231GJ2000PLC038352  
Registered Office: Zota House, 2/896, Hira Modi Street, Sagarampura, Surat-395001, Gujarat  
Ph: +91-261-2331601  
Email: info@zotahelthcare.com  
Website: www.zotahelthcare.com

INFORMATION REGARDING EXTRAORDINARY GENERAL MEETING TO BE HELD THROUGH VIDEO CONFERENCING ("VC") / OTHER AUDIO-VISUAL MEANS ("OAVM")  
In compliance with the applicable provisions of the Companies Act, 2013 read with General Circular No. 14/2020 dated April 08, 2020, No. 17/2020, dated April 13, 2020, No. 20/2020 dated May 05, 2020, No. 22/2020 dated June 15, 2020, No. 33/2020 dated September 28, 2020, No. 39/2020 dated December 31, 2020 and No. 10/2021 dated June 23, 2021 issued by Ministry of Corporate Affairs ("MCA") collectively referred as "MCA Circulars") and SEBI Circular No. SEBI/HO/CFD/CMD2/CIR/P/2021/11 dated January 15, 2021 issued by Securities and Exchange Board of India ("SEBI Circular"), the Extra Ordinary General Meeting ("EGM") of the members of Zota Health Care Limited ("the Company") will be held on Tuesday, September 07, 2021 at 11.00 AM, ("TST") through Video Conferencing ("VC") / Other Audio-Visual Means ("OAVM") as mentioned below.

MANNER OF REGISTERING / UPDATING EMAIL ADDRESSES - Members holding shares in dematerialized mode, are requested to register the email addresses and mobile numbers with their relevant depositories through their Depository Participants. Members holding shares in physical mode are requested to furnish their email addresses and mobile numbers with the Company's Registrar and Share Transfer Agent ("ST") mentioned below.

MANNER OF CASTING VOTE THROUGH E-VOTING - Members will have an opportunity to cast their vote(s) remotely through e-voting system and can cast their vote(s) through e-voting system during the EGM on the date of business as set out in the notice of EGM. The manner of voting for members holding shares in dematerialized mode, physical mode and for members who have not registered the email addresses will be provided in the Notice of EGM. The details will also be made available on the website of the company, members are requested to visit www.zotahelthcare.com for such details.

The notice of EGM will be sent to the shareholders in accordance with applicable laws and their email address in due course.

For Zota Health Care Limited  
Date: August 13, 2021  
Ashvin Varva  
Place: Surat  
Company Secretary & Compliance Officer

REAL STRIPS LIMITED

Registered Office: Survey No.245-246, Village Sari, Ahmedabad-Bavla Highway, Taluka Sanand, Dist.: Ahmedabad - 382220, Gujarat.  
CIN: L27100GJ1990PLC014383  
Telephone: +91 92280 02011, +91 92280 02012  
Email: ramcharan@realstrips.com Website: www.realstrips.com  
Com. No. Bombay Stock Exchange - 513558

Extract of Unaudited Financial Results for the Quarter Ended 30th June 2021 (Rs In Lacs except as stated)

PARTICULARS	Quarter ended		Year ended	
	30.06.2021	31.03.2021		30.06.2020
Total Income from operations	2,991.25	4,040.36	1,227.67	12,503.01
Net (Loss) for the period (before tax, exceptional and / or extraordinary items)	(17.85)	(1,572.63)	(279.56)	(1,341.77)
Net (Loss) for the period before tax (after exceptional and / or extraordinary items)	(17.85)	(1,572.63)	(279.56)	(1,341.77)
Net (Loss) for the period (after tax, exceptional and / or extraordinary items)	(17.85)	(1,630.49)	(279.56)	(1,399.63)
Total Comprehensive Income for the period (comprising profit for the period after tax and other comprehensive income after tax)		18.83		18.83
Equity Share Capital (Face value of Rs.10/- each)	597.50	597.50	597.50	597.50
Other Equity (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year				(3,062.72)
Earnings Per Share (For Continuing and Discontinued operations) (Amount in Rs.)				
- Basic & Diluted (Not annualised)	(0.30)	(27.27)	(4.67)	(23.41)

Notes:  
1. The above is an extract of the detailed format of quarterly ended financial results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the quarterly financial results are available on the websites of the Stock Exchanges and the listed entity. (www.realstrips.com).  
2. The Hon'ble NCLT, Ahmedabad Bench vide order dated 03rd March, 2021 passed in CP (IB) No. 307 / 2017/NCLT/AHM/2020 initiated the Corporate Insolvency Resolution Process (CIRP) under the provisions of the Insolvency and Bankruptcy Code, 2016. Mr. Ramchandra Dallarum Choudhary, has been appointed as the Resolution Professional (RP) by the Committee of Creditors (CoC). The RP has relied on the assistance provided by the members of the Audit Committee in review of the financial results and certifications, representations and statements made by the directors of the company in relation to these financial statements. The RP has taken on record the financial statements of the company in good faith and only to the limited extent of discharging the powers of the Board of directors of the company which has been conferred upon him under Section 17 of the Insolvency and Bankruptcy Code, 2016. The company had defaulted in the repayment of loan amounting to Rs 7,700.00 Lakhs being principal amount during the period from 07/09/2019 to 29/10/2019 and Rs 1,721.55 Lakhs towards interest during the period from 07/09/2019 to 29/10/2019. The financial creditor namely Rajshree Metal Industries Limited, Accordingly, Rajshree Metal has filed a petition before the Hon'ble National Company Law Tribunal (NCLT), Ahmedabad Bench under Section 7 of the Insolvency and Bankruptcy Code, 2016 (the Code) read with the rule 4 of the Insolvency and Bankruptcy Code (Application to the Adjudicating Authority) Rules, 2016 to initiate corporate insolvency resolution process against the Corporate Debtor. Further, on August 9, 2021, the RP has appointed Mr. Ramchandra Dallarum Choudhary as the Resolution Professional (RP) under the Insolvency and Bankruptcy Code, 2016 and appointed Mr. Ramchandra Dallarum Choudhary as the Interim Resolution Professional (IRP). Thereafter, in the first meeting of committee of creditors (CoC) held on 08th April, 2021 the members of the Committee of Creditors approved the appointment of Mr. Ramchandra Dallarum Choudhary as the Resolution Professional. Further, the resolution professional shall continue to manage the operations of the corporate debtor until the order approving the resolution plan under sub-section (1) of section 31 or appointing a liquidator under section 34 is passed by the Adjudicating Authority.

'Vayam' new video communication app to promote 'Make in India'



people's ability to meet and celebrate festivals together, video communication tools have become the go-to solution to celebrate their traditions. To enable this, 'Vayam' will create a special virtual room for every occasion to give users a close-to-real-life experience. Being an easy-to-use, credible, and secure application, Vayam's interactive features that are in tandem with Indian cultural sensitivities have made it the ideal and accessible solution in the country's video communication market. (1-7)

Ahmedabad, In a major development, Superpro, a B2B tech-powered advanced video communications startup, has forayed into the B2C space with the launch of 'Vayam' - Bharat's new video communication app. Aiming to promote the 'Make in India' pledge, 'Vayam' will cater to the Indian users' cultural sentiments with innovative, exciting features. The app will be one of the first homegrown platforms that will align with Indian users' beliefs and protect the sovereignty of the country, thereby eliminating the dependency that western apps such as Google and Zoom hold in the Indian market. Despite being the second-largest online market in the world, Indian apps are not among the top 10 video communication apps used as the market is dominated by foreign apps that may pose a threat to the country's security as well as user data. Besides, these apps don't align with the interests of Indian users. With the ability to design virtual rooms as per every single Indian occasion such as Satsang, Aarti, Pujan, Keertan, etc., to offer users a one-of-a-kind virtual experience, 'Vayam' is a 'Made in India, Made for India' app. As the pandemic has limited

WESTERN RAILWAY - RAJKOT DIVISION  
VARIOUS ENGINEERING WORKS  
Sl. No. Tender No. Name of work Approximate MT Cost (Rs.)  
1. W.R. J.T. 21. 21/2021. 21/2021. 21/2021. 21/2021. 3,56,45,389.15  
2. W.R. J.T. 21. 21/2021. 21/2021. 21/2021. 21/2021. 9,28,399.02  
3. W.R. J.T. 21. 21/2021. 21/2021. 21/2021. 21/2021. 1,25,11,142.14  
4. W.R. J.T. 21. 21/2021. 21/2021. 21/2021. 21/2021. 4,97,463.30

UTL Industries Limited  
(Previously known as Uni Tubes Limited)  
Registered Office: 607 World Trade Centre Sayajirao VADODARA-390001  
Tel: +91 265 2363497, Email: utlindustries@gmail.com  
Website: www.utlindustries.com, CIN: L27100GJ1999PLC012843

EXTRACT OF UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED 30TH JUNE, 2021 (Rs. in lakhs)

Sl. No.	PARTICULARS	QUARTER ENDED		YEAR ENDED	
		Unaudited 30-Jun-21	Audited 31-Mar-21	Unaudited 30-Jun-20	Audited 31-Mar-21
1	Total Income from Operations	6.13	161.41	15.72	215.20
2	Net Profit for the period (before Tax, Exceptional and/or Extraordinary Items)	0.17	32.81	0.23	62.27
3	Net Profit for the period before Tax (after Exceptional and/or Extraordinary Items)	0.37	32.91	0.62	44.48
4	Net Profit for the period after Tax (after Exceptional and/or Extraordinary Items)	0.30	23.15	0.49	32.45
5	Total Comprehensive Income for the period (Comprising Profit/(Loss) for the period (after Tax) and Other Comprehensive Income (after Tax))	0.30	23.15	0.49	32.46
6	Equity Share Capital	329.55	329.55	329.55	329.55
7	Other Equity (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year	0.01	0.01	0.00	0.30

Notes:  
1. The above is an extract of the detailed format of Unaudited Financial Results pursuant to Regulation 25 of Securities Contracts (Regulation) (Stock Exchange & Clearing Corporations) Regulation, 2018, as amended from time to time, read with Regulation 25 of the Securities Contracts (Regulation) (Stock Exchange & Clearing Corporations) Regulation, 2018.  
2. The above is an extract of quarter ended results which have been reviewed by the Audit Committee and approved by the Board of Directors of the Company at their respective meetings held on 13th of August 2021.  
3. The financial figures for the last quarter ended 31st March 2021 are the balancing figures between the audited figures in respect of the full financial year ended on 31st March, 2021 and the year to date figures upto the third quarter ended 31st December, 2020.  
4. Company operates in two segments viz. Construction and SMS Services. Separate information in terms of Ind AS 108 "Operating Segment" is reported as the total revenue is 10% or more of combined revenue of all operating segments.  
5. Previous year figures have been regrouped and rearranged, to conform to the current period's classification.  
6. Loss account is in accordance with Ind AS 108.  
7. The full format of Quarterly Financial Results are available on the websites of the stock exchanges (www.bseindia.com and www.nseindia.com) and company's website (www.utlindustries.com).  
By Order of the Board  
For UTL Industries Ltd.  
Bhavik Vasanthlal Patel, Sd/-  
DIN : 07521766

compliance by the Corporate Debtor with applicable laws, and subject to the following directions:  
a) The RP has signed and furnished the report in good faith and accordingly, no suit, prosecution or other legal proceedings shall lie against the RP in terms of Section 233 of the Code.  
b) No representation, fact, information (whether current or historical) or opinion contained herein should be construed as a representation or warranty, express or implied, of the RP, including his, authorised representative.  
c) The RP in review of the unaudited financial results and while signing this statement of financial results, has relied upon the assistance provided by the directors of the Corporate Debtor, and certifications, representations and statements made by the directors of the Corporate Debtor, in relation to these financial results. The statement of financial results of the Corporate Debtor for the quarter ended June 30, 2021 have been taken on record by the RP solely on the basis of and on relying the aforesaid certifications, representations and statements of the aforesaid directors and the erstwhile management of the Corporate Debtor. For all such information and data, the RP has assumed that such information and data are in the conformity with the Companies Act, 2013 and other applicable laws with respect to the preparation of the financial results and that they give true and fair view of the position of the Corporate Debtor as of the dates and period indicated therein. Accordingly, the RP is not making any representations regarding accuracy, veracity or completeness of the data or information in the financial results."  
As per the requirement of the "IBC, 2016" and "CIRP Regulations" Resolution Professional has invited expression of Interest (EOI) from prospective Resolution Applicants (RA) to submit the Resolution Plan for the Company. The resolution plan received was placed in the third meeting of CoC held on June 25, 2021 and the same was approved by all the members of the CoC with requisite majority through the e-voting process. Accordingly, the Resolution Professional has filed an application for approval of resolution plan under Section 30(6) read with Section 31 of the Insolvency and Bankruptcy Code, 2016 and read along with the Regulation 39(4) of the Insolvency and Bankruptcy Board of India (Insolvency Process of Corporate Persons) Regulations, 2016 and the same is pending before the Hon'ble NCLT, Ahmedabad Bench.  
The financial results for the quarter ended on June 30, 2021 have been prepared by the management of the Company and certified by Mr. Ramcharan Beriwal, Chief Financial Officer ("CFO") of the company in accordance with Regulation 33(2) of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. "The financial results were placed before the RP, the Chief Financial Officer and the Company Secretary on August 13, 2021 for their consideration. Accordingly, the unaudited financial results were considered and recommended in their meeting. In view thereof, the RP, in reliance of such examination by and the representation, clarifications and explanation provided by the CFO, has taken record of the same. The RP has taken on record these unaudited financial results only to the limited extent of discharging the powers of the Board of Directors of the Company which has been conferred upon him under Section 17 of the Insolvency and Bankruptcy Code, 2016. The future prospects of the Company would be determined on the completion of CIRP. Hence, the RP has not prepared the unaudited financial results for the quarter ended on June 30, 2021. The RP has not prepared the unaudited financial results for the quarter ended on June 30, 2021. The company is continuing to operate as a going concern after commencement of CIRP as per the directions issued by the Hon'ble NCLT, Ahmedabad Bench vide its order dated 9th March, 2021. "The future prospects of the Company would be determined on the completion of CIRP. Hence, the RP has not prepared the unaudited financial results for the quarter ended on June 30, 2021. The RP has not prepared the unaudited financial results for the quarter ended on June 30, 2021. The company is continuing to operate as a going concern after commencement of CIRP as per the directions issued by the Hon'ble NCLT, Ahmedabad Bench vide its order dated 9th March, 2021. "The future prospects of the Company would be determined on the completion of CIRP. Hence, the RP has not prepared the unaudited financial results for the quarter ended on June 30, 2021. The RP has not prepared the unaudited financial results for the quarter ended on June 30, 2021. The company is continuing to operate as a going concern after commencement of CIRP as per the directions issued by the Hon'ble NCLT, Ahmedabad Bench vide its order dated 9th March, 2021. "The future prospects of the Company would be determined on the completion of CIRP. Hence, the RP has not prepared the unaudited financial results for the quarter ended on June 30, 2021. The RP has not prepared the unaudited financial results for the quarter ended on June 30, 2021. The company is continuing to operate as a going concern after commencement of CIRP as per the directions issued by the Hon'ble NCLT, Ahmedabad Bench vide its order dated 9th March, 2021. "The future prospects of the Company would be determined on the completion of CIRP. Hence, the RP has not prepared the unaudited financial results for the quarter ended on June 30, 2021. The RP has not prepared the unaudited financial results for the quarter ended on June 30, 2021. The company is continuing to operate as a going concern after commencement of CIRP as per the directions issued by the Hon'ble NCLT, Ahmedabad Bench vide its order dated 9th March, 2021. "The future prospects of the Company would be determined on the completion of CIRP. Hence, the RP has not prepared the unaudited financial results for the quarter ended on June 30, 2021. The RP has not prepared the unaudited financial results for the quarter ended on June 30, 2021. The company is continuing to operate as a going concern after commencement of CIRP as per the directions issued by the Hon'ble NCLT, Ahmedabad Bench vide its order dated 9th March, 2021. "The future prospects of the Company would be determined on the completion of CIRP. Hence, the RP has not prepared the unaudited financial results for the quarter ended on June 30, 2021. The RP has not prepared the unaudited financial results for the quarter ended on June 30, 2021. The company is continuing to operate as a going concern after commencement of CIRP as per the directions issued by the Hon'ble NCLT, Ahmedabad Bench vide its order dated 9th March, 2021. "The future prospects of the Company would be determined on the completion of CIRP. Hence, the RP has not prepared the unaudited financial results for the quarter ended on June 30, 2021. The RP has not prepared the unaudited financial results for the quarter ended on June 30, 2021. The company is continuing to operate as a going concern after commencement of CIRP as per the directions issued by the Hon'ble NCLT, Ahmedabad Bench vide its order dated 9th March, 2021. "The future prospects of the Company would be determined on the completion of CIRP. Hence, the RP has not prepared the unaudited financial results for the quarter ended on June 30, 2021. The RP has not prepared the unaudited financial results for the quarter ended on June 30, 2021. The company is continuing to operate as a going concern after commencement of CIRP as per the directions issued by the Hon'ble NCLT, Ahmedabad Bench vide its order dated 9th March, 2021. "The future prospects of the Company would be determined on the completion of CIRP. Hence, the RP has not prepared the unaudited financial results for the quarter ended on June 30, 2021. The RP has not prepared the unaudited financial results for the quarter ended on June 30, 2021. The company is continuing to operate as a going concern after commencement of CIRP as per the directions issued by the Hon'ble NCLT, Ahmedabad Bench vide its order dated 9th March, 2021. "The future prospects of the Company would be determined on the completion of CIRP. Hence, the RP has not prepared the unaudited financial results for the quarter ended on June 30, 2021. The RP has not prepared the unaudited financial results for the quarter ended on June 30, 2021. The company is continuing to operate as a going concern after commencement of CIRP as per the directions issued by the Hon'ble NCLT, Ahmedabad Bench vide its order dated 9th March, 2021. "The future prospects of the Company would be determined on the completion of CIRP. Hence, the RP has not prepared the unaudited financial results for the quarter ended on June 30, 2021. The RP has not prepared the unaudited financial results for the quarter ended on June 30, 2021. The company is continuing to operate as a going concern after commencement of CIRP as per the directions issued by the Hon'ble NCLT, Ahmedabad Bench vide its order dated 9th March, 2021. "The future prospects of the Company would be determined on the completion of CIRP. Hence, the RP has not prepared the unaudited financial results for the quarter ended on June 30, 2021. The RP has not prepared the unaudited financial results for the quarter ended on June 30, 2021. The company is continuing to operate as a going concern after commencement of CIRP as per the directions issued by the Hon'ble NCLT, Ahmedabad Bench vide its order dated 9th March, 2021. "The future prospects of the Company would be determined on the completion of CIRP. Hence, the RP has not prepared the unaudited financial results for the quarter ended on June 30, 2021. The RP has not prepared the unaudited financial results for the quarter ended on June 30, 2021. The company is continuing to operate as a going concern after commencement of CIRP as per the directions issued by the Hon'ble NCLT, Ahmedabad Bench vide its order dated 9th March, 2021. "The future prospects of the Company would be determined on the completion of CIRP. Hence, the RP has not prepared the unaudited financial results for the quarter ended on June 30, 2021. The RP has not prepared the unaudited financial results for the quarter ended on June 30, 2021. The company is continuing to operate as a going concern after commencement of CIRP as per the directions issued by the Hon'ble NCLT, Ahmedabad Bench vide its order dated 9th March, 2021. "The future prospects of the Company would be determined on the completion of CIRP. Hence, the RP has not prepared the unaudited financial results for the quarter ended on June 30, 2021. The RP has not prepared the unaudited financial results for the quarter ended on June 30, 2021. The company is continuing to operate as a going concern after commencement of CIRP as per the directions issued by the Hon'ble NCLT, Ahmedabad Bench vide its order dated 9th March, 2021. "The future prospects of the Company would be determined on the completion of CIRP. Hence, the RP has not prepared the unaudited financial results for the quarter ended on June 30, 2021. The RP has not prepared the unaudited financial results for the quarter ended on June 30, 2021. The company is continuing to operate as a going concern after commencement of CIRP as per the directions issued by the Hon'ble NCLT, Ahmedabad Bench vide its order dated 9th March, 2021. "The future prospects of the Company would be determined on the completion of CIRP. Hence, the RP has not prepared the unaudited financial results for the quarter ended on June 30, 2021. The RP has not prepared the unaudited financial results for the quarter ended on June 30, 2021. The company is continuing to operate as a going concern after commencement of CIRP as per the directions issued by the Hon'ble NCLT, Ahmedabad Bench vide its order dated 9th March, 2021. "The future prospects of the Company would be determined on the completion of CIRP. Hence, the RP has not prepared the unaudited financial results for the quarter ended on June 30, 2021. The RP has not prepared the unaudited financial results for the quarter ended on June 30, 2021. The company is continuing to operate as a going concern after commencement of CIRP as per the directions issued by the Hon'ble NCLT, Ahmedabad Bench vide its order dated 9th March, 2021. "The future prospects of the Company would be determined on the completion of CIRP. Hence, the RP has not prepared the unaudited financial results for the quarter ended on June 30, 2021. The RP has not prepared the unaudited financial results for the quarter ended on June 30, 2021. The company is continuing to operate as a going concern after commencement of CIRP as per the directions issued by the Hon'ble NCLT, Ahmedabad Bench vide its order dated 9th March, 2021. "The future prospects of the Company would be determined on the completion of CIRP. Hence, the RP has not prepared the unaudited financial results for the quarter ended on June 30, 2021. The RP has not prepared the unaudited financial results for the quarter ended on June 30, 2021. The company is continuing to operate as a going concern after commencement of CIRP as per the directions issued by the Hon'ble NCLT, Ahmedabad Bench vide its order dated 9th March, 2021. "The future prospects of the Company would be determined on the completion of CIRP. Hence, the RP has not prepared the unaudited financial results for the quarter ended on June 30, 2021. The RP has not prepared the unaudited financial results for the quarter ended on June 30, 2021. The company is continuing to operate as a going concern after commencement of CIRP as per the directions issued by the Hon'ble NCLT, Ahmedabad Bench vide its order dated 9th March, 2021. "The future prospects of the Company would be determined on the completion of CIRP. Hence, the RP has not prepared the unaudited financial results for the quarter ended on June 30, 2021. The RP has not prepared the unaudited financial results for the quarter ended on June 30, 2021. The company is continuing to operate as a going concern after commencement of CIRP as per the directions issued by the Hon'ble NCLT, Ahmedabad Bench vide its order dated 9th March, 2021. "The future prospects of the Company would be determined on the completion of CIRP. Hence, the RP has not prepared the unaudited financial results for the quarter ended on June 30, 2021. The RP has not prepared the unaudited financial results for the quarter ended on June 30, 2021. The company is continuing to operate as a going concern after commencement of CIRP as per the directions issued by the Hon'ble NCLT, Ahmedabad Bench vide its order dated 9th March, 2021. "The future prospects of the Company would be determined on the completion of CIRP. Hence, the RP has not prepared the unaudited financial results for the quarter ended on June 30, 2021. The RP has not prepared the unaudited financial results for the quarter ended on June 30, 2021. The company is continuing to operate as a going concern after commencement of CIRP as per the directions issued by the Hon'ble NCLT, Ahmedabad Bench vide its order dated 9th March, 2021. "The future prospects of the Company would be determined on the completion of CIRP. Hence, the RP has not prepared the unaudited financial results for the quarter ended on June 30, 2021. The RP has not prepared the unaudited financial results for the quarter ended on June 30, 2021. The company is continuing to operate as a going concern after commencement of CIRP as per the directions issued by the Hon'ble NCLT, Ahmedabad Bench vide its order dated 9th March, 2021. "The future prospects of the Company would be determined on the completion of CIRP. Hence, the RP has not prepared the unaudited financial results for the quarter ended on June 30, 2021. The RP has not prepared the unaudited financial results for the quarter ended on June 30, 2021. The company is continuing to operate as a going concern after commencement of CIRP as per the directions issued by the Hon'ble NCLT, Ahmedabad Bench vide its order dated 9th March, 2021. "The future prospects of the Company would be determined on the completion of CIRP. Hence, the RP has not prepared the unaudited financial results for the quarter ended on June 30, 2021. The RP has not prepared the unaudited financial results for the quarter ended on June 30, 2021. The company is continuing to operate as a going concern after commencement of CIRP as per the directions issued by the Hon'ble NCLT, Ahmedabad Bench vide its order dated 9th March, 2021. "The future prospects of the Company would be determined on the completion of CIRP. Hence, the RP has not prepared the unaudited financial results for the quarter ended on June 30, 2021. The RP has not prepared the unaudited financial results for the quarter ended on June 30, 2021. The company is continuing to operate as a going concern after commencement of CIRP as per the directions issued by the Hon'ble NCLT, Ahmedabad Bench vide its order dated 9th March, 2021. "The future prospects of the Company would be determined on the completion of CIRP. Hence, the RP has not prepared the unaudited financial results for the quarter ended on June 30, 2021. The RP has not prepared the unaudited financial results for the quarter ended on June 30, 2021. The company is continuing to operate as a going concern after commencement of CIRP as per the directions issued by the Hon'ble NCLT, Ahmedabad Bench vide its order dated 9th March, 2021. "The future prospects of the Company would be determined on the completion of CIRP. Hence, the RP has not prepared the unaudited financial results for the quarter ended on June 30, 2021. The RP has not prepared the unaudited financial results for the quarter ended on June 30, 2021. The company is continuing to operate as a going concern after commencement of CIRP as per the directions issued by the Hon'ble NCLT, Ahmedabad Bench vide its order dated 9th March, 2021. "The future prospects of the Company would be determined on the completion of CIRP. Hence, the RP has not prepared the unaudited financial results for the quarter ended on June 30, 2021. The RP has not prepared the unaudited financial results for the quarter ended on June 30, 2021. The company is continuing to operate as a going concern after commencement of CIRP as per the directions issued by the Hon'ble NCLT, Ahmedabad Bench vide its order dated 9th March, 2021. "The future prospects of the Company would be determined on the completion of CIRP. Hence, the RP has not prepared the unaudited financial results for the quarter ended on June 30, 2021. The RP has not prepared the unaudited financial results for the quarter ended on June 30, 2021. The company is continuing to operate as a going concern after commencement of CIRP as per the directions issued by the Hon'ble NCLT, Ahmedabad Bench vide its order dated 9th March, 2021. "The future prospects of the Company would be determined on the completion of CIRP. Hence, the RP has not prepared the unaudited financial results for the quarter ended on June 30, 2021. The RP has not prepared the unaudited financial results for the quarter ended on June 30, 2021. The company is continuing to operate as a going concern after commencement of CIRP as per the directions issued by the Hon'ble NCLT, Ahmedabad Bench vide its order dated 9th March, 2021. "The future prospects of the Company would be determined on the completion of CIRP. Hence, the RP has not prepared the unaudited financial results for the quarter ended on June 30, 2021. The RP has not prepared the unaudited financial results for the quarter ended on June 30, 2021. The company is continuing to operate as a going concern after commencement of CIRP as per the directions issued by the Hon'ble NCLT, Ahmedabad Bench vide its order dated 9th March, 2021. "The future prospects of the Company would be determined on the completion of CIRP. Hence, the RP has not prepared the unaudited financial results for the quarter ended on June 30, 2021. The RP has not prepared the unaudited financial results for the quarter ended on June 30, 2021. The company is continuing to operate as a going concern after commencement of CIRP as per the directions issued by the Hon'ble NCLT, Ahmedabad Bench vide its order dated 9th March, 2021. "The future prospects of the Company would be determined on the completion of CIRP. Hence, the RP has not prepared the unaudited financial results for the quarter ended on June 30, 2021. The RP has not prepared the unaudited financial results for the quarter ended on June 30, 2021. The company is continuing to operate as a going concern after commencement of CIRP as per the directions issued by the Hon'ble NCLT, Ahmedabad Bench vide its order dated 9th March, 2021. "The future prospects of the Company would be determined on the completion of CIRP. Hence, the RP has not prepared the unaudited financial results for the quarter ended on June 30, 2021. The RP has not prepared the unaudited financial results for the quarter ended on June 30, 2021. The company is continuing to operate as a going concern after commencement of CIRP as per the directions issued by the Hon'ble NCLT, Ahmedabad Bench vide its order dated 9th March, 2021. "The future prospects of the Company would be determined on the completion of CIRP. Hence, the RP has not prepared the unaudited financial results for the quarter ended on June 30, 2021. The RP has not prepared the unaudited financial results for the quarter ended on June 30, 2021. The company is continuing to operate as a going concern after commencement of CIRP as per the directions issued by the Hon'ble NCLT, Ahmedabad Bench vide its order dated 9th March, 2021. "The future prospects of the Company would be determined on the completion of CIRP. Hence, the RP has not prepared the unaudited financial results for the quarter ended on June 30, 2021. The RP has not prepared the unaudited financial results for the quarter ended on June 30, 2021. The company is continuing to operate as a going concern after commencement of CIRP as per the directions issued by the Hon